



ઓનલાઇન આપેલ ખુલવાની તારીખ અને સમય	૩૦-૦૭-૨૦૨૫ના રોજ ૧૦.૦૦ કલાકે
ઓનલાઇન આપેલ બંધ થવાની તારીખ અને સમય	૨૬-૦૮-૨૦૨૫ના રોજ ૧૮-૦૦ કલાકે

૧. પશ્ચિમ રેલવે વર્ષ ૨૦૨૫-૨૬ માટે પશ્ચિમ રેલવેના અધિકાર ક્ષેત્ર હેઠળ ખુલ્લી જાહેરાત દ્વારા પાત્રતા ધરાવતા સ્પોર્ટ્સ પર્સનલ પાસેથી નીચેની શાખાઓમાં/પગલ ધોરણ મુજબ ગ્રુપ સીના ૨૧ પદો અને ૪૩ (પૂર્વ ગ્રુપ ડી) પદોની ભરતી કરવા તેમની પાસે દરેક વર્ષે સ્પોર્ટ્સ ક્વોટા ભરતી કરવા માટે ઓનલાઇન ભરતીગુણો સામંત્રિત કરે છે.

પદોનું ઊંચ-ચપ - શાખાવાર

(એ) લેવલ ૩/૨ (બંધુ પીસી)

શાખા	ઇવેન્ટ/પ્રોફીસીયનલી/વજન કૅટેગરી	જગ્યાઓ
ક્રિકેટ (એમ)	ઓપનીંગ બેટ્સમેન, ફાસ્ટ બોલર, સ્પીનર, ઓલ રાઉન્ડર સ્પીન, ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડર	૧
ક્રિકેટ (ડબલ્યુ)	બેટ્સપુમન, ઓલ રાઉન્ડર, સ્પિન બોલર	૧
કબડ્ડી (એમ)	લેફ્ટ કોર્નર, રાઇટ કોર્નર, ઓલ રાઉન્ડર	૧
કબડ્ડી (ડબલ્યુ)	લેફ્ટ રેફડર સહ લેફ્ટ કવર, લેફ્ટ રેઇડર, રાઇટ કવર સહ રાઇટ કોર્નર	૧
ટેસ્ટીંગ (એમ) ફી સ્ટાઇલ	૬૧ કિગ્રા., ૭૯ કિગ્રા., ૧૨૫ કિગ્રા.	૧
	કુલ	૦૫

(બી) લેવલ ૩/૨ (બંધુ પીસી)

શાખા	ઇવેન્ટ/પ્રોફીસીયનલી/વજન કૅટેગરી	જગ્યાઓ
બાસ્કેટબોલ (એમ)	ગુર્ડિંગ ગાર્ડ, સેન્ટર (પોસ્ટ પ્લેયર)	૨
ક્રિકેટ (એમ)	ઓપનીંગ બેટ્સમેન, ફાસ્ટ બોલર, સ્પીનર, ઓલ રાઉન્ડર સ્પીન, ફાસ્ટ બોલર ઓલ રાઉન્ડર	૨
ક્રિકેટ (ડબલ્યુ)	બેટ્સપુમન, ઓલ રાઉન્ડર, સ્પિન બોલર	૨
હૅન્ડબોલ (એમ)	લેફ્ટ બેક, સેન્ટર બેક, રાઇટ વિંગ, ગોલ કીપર	૨
કબડ્ડી (એમ)	લેફ્ટ કોર્નર, રાઇટ કોર્નર, ઓલ રાઉન્ડર	૧
કબડ્ડી (ડબલ્યુ)	લેફ્ટ રેફડર સહ લેફ્ટ કવર, લેફ્ટ રેઇડર, રાઇટ કવર સહ રાઇટ કોર્નર	૧
પાવરલિફ્ટિંગ (એમ)	૬૬ કિગ્રા., ૮૩ કિગ્રા., ૧૨૦ કિગ્રા., + ૧૨૦ કિગ્રા.થી વધુ	૨
ટેબલ ટેનિસ (ડબલ્યુ)	સિંગલ, ડબલ, ટીમ	૧
ટેસ્ટીંગ (ડબલ્યુ) ફી સ્ટાઇલ	૫૫ કિગ્રા., ૬૮ કિગ્રા., ૭૨ કિગ્રા.	૧

શાખા	ઇવેન્ટ/પ્રોફીસીયનલી/વજન કૅટેગરી	જગ્યાઓ
ટેસ્ટીંગ (એમ) ફી સ્ટાઇલ	૬૧ કિગ્રા., ૭૯ કિગ્રા., ૧૨૫ કિગ્રા.	૧
વેઇટલિફ્ટિંગ (ડબલ્યુ)	૫૯ કિગ્રા., ૬૪ કિગ્રા., ૭૧ કિગ્રા. (નવી વજન કૅટેગરીમાં ૫૮ કિગ્રા., ૬૩ કિગ્રા., ૭૭ કિગ્રા.)	૧
	કુલ	૧૬

(સી) લેવલ ૧ (બંધુ પીસી)

શાખા	ઇવેન્ટ/પ્રોફીસીયનલી/વજન કૅટેગરી	જગ્યાઓ
એથલેટીક્સ (એમ)	૪૦૦ મી., ૪૦૦ મી. હર્ડલ્સ, ૮૦૦ મી., ૫૦૦૦ મી., ૧૦૦૦૦ મી.	૨
એથલેટીક્સ (ડબલ્યુ)	૪૦૦ મી. હર્ડલ્સ, લાંબો કૂદકો, ટ્રિપલ જમ્પ, જેવલિન થ્રો	૩
બાસ્કેટબોલ (ડબલ્યુ)	ઓલ રાઉન્ડર	૨
બોડીબિલ્ડિંગ (એમ)	૫૫ કિગ્રા., ૬૦ કિગ્રા., ૬૫ કિગ્રા. ૮૫ કિગ્રા., ૯૦ કિગ્રા., ૧૦૦ કિગ્રા.થી વધુ	૩
સાઇકલિંગ (પુરુષ)	૪૦ કિમી ઇન્ડિવિડ્યુઅલ ટાઇમ ટ્રાયલ, ૧૨૦ કિમી ઇન્ડિવિડ્યુઅલ રોડ રેસ	૩
જિમ્નોસ્ટિક્સ (એમ)	ઓલ રાઉન્ડર, ફ્લોર એક્સસાઇઝ, પોમેલ હોર્સ, સ્ટિલ રિંગ્સ, વોલ્ટ, પેરેલલ બાર્સ, હોરિઝોન્ટલ બાર	૨
કૂટબોલ (એમ)	ગોલકીપર, ડિફેન્ડર, મિડફિલ્ડર, સ્ટ્રાઇકર	૩
હોકી (એમ)	ડિફેન્ડર, મિડફિલ્ડર, ફોરવર્ડ	૨
હોકી (ડબલ્યુ)	સ્ટ્રીકર, મિડફિલ્ડર, ઓલ રાઉન્ડર	૨
હૅન્ડબોલ (ડબલ્યુ)	રાઇટ બેક, સેન્ટર બેક, લેફ્ટ વિંગ, પિવોટ, ઓલ રાઉન્ડર	૪
ખો-ખો (એમ)	ઓલ રાઉન્ડર	૨
ખો-ખો (ડબલ્યુ)	ઓલ રાઉન્ડર	૪
પાવરલિફ્ટિંગ (ડબલ્યુ)	૫૨ કિગ્રા., ૬૩ કિગ્રા., ૮૪ કિગ્રા., + ૮૪ કિગ્રા.થી વધુ	૨
વોલી બોલ (ડબલ્યુ)	સેટર, બ્લોકર, લિબેરો, સ્પેક્ટર, ઓલ રાઉન્ડર	૩
સ્વિમિંગ (એમ)	૨૦૦ મી. બટરફ્લાય, ૨૦૦ મી. ઇન્ડિવિડ્યુઅલ મિડલે, ૪૦૦ મી. ઇન્ડિવિડ્યુઅલ મિડલે, ૧૦૦ મી. ફ્રીસ્ટાઇલ	૨
વોટર પોલો (એમ)	સેન્ટર બેક, સેન્ટર ફોરવર્ડ	૨
વેઇટલિફ્ટિંગ (એમ)	૭૩ કિગ્રા., ૮૧ કિગ્રા., ૧૦૨ કિગ્રા. (નવી વજન કૅટેગરીમાં ૭૧ કિગ્રા., ૭૯ કિગ્રા., ૯૮ કિગ્રા.)	૧
	કુલ	૪૩

૨. સ્પોર્ટ્સ સોશીયમેન્ટસ : કુલ ૨૦૫૧ ૧૧ સ્પોર્ટ્સ ક્લબ્સ/કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રગામિનિમાં ૦૧-૦૪-૨૦૨૩ થી એમ્પ્લોયમેન્ટમાં પાત્રતા મેળવી હોય અને હાલમાં સક્રિય હોય તેવા ઉપરની જગ્યા માટે સ્પોર્ટ્સ ક્વોટા હેઠળ અરજી કરવાલાયક ગણાશે.

૩. તમામ રીસે પૂર્ણ ભરતીગુણો લા. ૨૬.૦૮.૨૦૨૫ના રોજ સાંજે ૧૮.૦૦ કલાક સુધી ઓનલાઇન વખા કરવાની રહેશે.

૪. વિસ્તૃત માહિતી માટે સ્નાતકાર્થી-ડબલ્યુઆરની વેબસાઈટ <https://www.rtc-wr.com> પર લોગ ઓન કરો.